

# IIT - Gandhinagar કેમ્પસને હુડકો એવોર્ડ

સિટી રિપોર્ટર  @ahm\_cb

ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી, ગાંધીનગરને હાઉસિંગ એન્ડ અર્બન ડેવલોપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ ડિઝાઇન એવોર્ડ્સ 2015 એનાયત થયો. આઈઆઈટી-જીએનનાં પાલેજનાં નવા કેમ્પસનાં નવાં સ્ટાફ હાઉસિંગ અને સ્ટુડન્ટ હોસ્ટેલે 'કોસ્ટ ઈફેક્ટિવ રુરલ-અર્બન હાઉસિંગ ઈન્ક્લુડિંગ ડિઝાસ્ટર રેસિસ્ટન્ટ હાઉસિંગ'ની કેટેગરીમાં એવોર્ડ જીતી લીધો છે. આઈઆઈટીજીએનને આ એવોર્ડ

ખાસ તેમણે બનાવેલી બિલ્ડિંગ ટેકનોલોજીને લીધે મળ્યો છે. તેમણે બિલ્ડિંગને ભૂકંપ રેઝિસ્ટન્ટ ટેકનોલોજીથી તૈયાર કરી છે. આઈઆઈટી-જીએનનાં ડાયરેક્ટર પ્રો. સુધીર જૈને કહ્યું કે, અમારું આ 400 એકરનું સાબરમતી નદીનાં કિનારે આવેલાં કેમ્પસનાં વિકાસે અમને નવી શોધની તક આપી. 'હુડકો' એવોર્ડ કેમ્પસ ડેવલોપમેન્ટમાં ઈનોવેશન્સ માટે જાણીતાં છે. ભારતમાં ભૂકંપ રેઝિસ્ટન્ટ કન્સ્ટ્રક્શને એક પદ્ધતિસરનાં કન્સ્ટ્રક્શનની શક્યતા ઊભી કરી છે.'

સિટી  
પ્રાઈડ